

ડિસેમ્બર 19, 2018

સીટી ઓફ બ્રામ્પટન નાગરિકોની નિમણૂક કરશે

સીટી નાગરિકો આધારિત સલાહકારી સમિતિઓ, ન્યાય-વિષયક સમિતિઓ, વહીવટી પંચ અને સંબંધિત નિમણૂકો માટે નાગરિકોની નિમણૂક કરવા આમંત્રણ આપે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – તમામ બ્રામ્પટન રહેવાસીઓને પોતાના શહેરના કાર્યોમાં સામેલ થવાનું આમંત્રણ છે - સીટી ઓફ બ્રામ્પટનની કાઉન્સિલ ઓફ ધી કોર્પોરેશન કાઉન્સિલના વર્ષ 2018-2022 નાં સમયગાળા માટે, જે નવેમ્બર 2022 માં અથવા અનુગામીની નિમણૂક થાય ત્યારે પૂરો થશે, વિવિધ નિમણૂકોમાં રસ ધરાવતા નાગરિકો પાસેથી અરજીઓ મંગાવી રહ્યું છે.

આ સીટીને નાગરિકો આધારિત સલાહકારી સમિતિઓ, ન્યાય-વિષયક સમિતિઓ, વહીવટી પંચ અને સંબંધિત નિમણૂકો માટે નાગરિકોની નીચે જણાવ્યા પ્રમાણે જરૂરિયાત છે:

નાગરિકો આધારિત સલાહકારી સમિતિઓ (સીટીઝન બેઝ્ડ એડવાઇઝરી કમિટીસ)

- સુલભતા સલાહકારી સમિતિ (એક્સેસિબિલિટી એડવાઇઝરી કમિટી)
- ઉંમર-અનુકૂળ બ્રામ્પટન સલાહકારી સમિતિ (એજ-ફ્રેન્ડલી બ્રામ્પટન એડવાઇઝરી કમિટી) (જેમાં પુખ્ત ઉંમરની ત્રણ વ્યક્તિઓ (55+) અને 15-24 વર્ષની ત્રણ વ્યક્તિઓની જરૂર છે)
- બ્રામ્પટન સામુદાયિક સુરક્ષા સલાહકારી સમિતિ (બ્રામ્પટન કમ્યુનિટી સેફ્ટી એડવાઇઝરી કમિટી) (જેમાં ચાર નાગરિક પ્રતિનિધિઓની જરૂર છે, હાઇવે 410 અને ફ્લીન સ્ટ્રીટથી વિભાજિત શહેરના ચાર ચરણોમાંના દરેકમાંથી એક પ્રતિનિધિ)
- બ્રામ્પટન હેરિટેજ બોર્ડ
- બ્રામ્પટન સ્કૂલ ટ્રાફિક સેફ્ટી કાઉન્સિલ (સુરક્ષા પરિષદ)
- સાયકલિંગ સલાહકારી સમિતિ
- પર્યાવરણ સલાહકારી સમિતિ
- સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ (પ્રખ્યાત રમતવીરો સંબંધિત) સમિતિ

ન્યાય-વિષયક સમિતિઓ, વહીવટી પંચ અને અન્ય નિમણૂકો (એડજ્યુડિકેટિવ કમિટીસ, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ એન્ડ અધર એપોઇન્ટમેન્ટ્સ)

- ઓડિટ સમિતિ (નાણાકીય પશ્ચાદભૂ ધરાવતા ત્રણ જેટલા નાગરિકો)

- વહીવટી નાણાં વિષયક ઇંડ પદ્ધતિ તપાસ સમીક્ષા અધિકારી (એડમિનિસ્ટ્રેટિવ મોનેટરી પેનલ્ટી સિસ્ટમ સ્કીનિંગ રિવ્યુ ઓફિસર)
- વહીવટી નાણાં વિષયક ઇંડ પદ્ધતિ સુનાવણી સમીક્ષા અધિકારી (એડમિનિસ્ટ્રેટિવ મોનેટરી પેનલ્ટી સિસ્ટમ હિયરીંગ રિવ્યુ ઓફિસર)
- બ્રામ્પટન અપીલ ટ્રિબ્યુનલ (પંચ)
- અનુકૂળન સમિતિ (કમિટી ઓફ એડજસ્ટમેન્ટ)
- ચૂંટણી અનુપાલન ઓડિટ સમિતિ (વૈકલ્પિક સભ્યો)
- મિલકત ધોરણોની સમિતિ (પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ્સ કમિટી)

આ નિમણૂકોમાં શહેર માટે અર્થસભર પ્રભાવ પાડવા રહેવાસીઓનો સમય અને તેઓની સક્રિય સહભાગિતાની જરૂર પડે છે. લાયકાતો અને જવાબદારીઓ સહિત, નિમણૂકની તકો વિશે વધુ માહિતી માટે, કૃપા કરી વેબસાઇટ જુઓ

www.brampton.ca.

દરેક સમિતિ/નિમણૂક માટે અરજી ફોર્મ્સ અને સંદર્ભની શરતો આ સીટીની વેબસાઇટ www.brampton.ca પર, બ્રામ્પટન સીટી હોલમાં સીટી ક્લાર્કની ઓફિસમાંથી લેવા માટે અથવા માહિતી ટપાલથી મોકલવાની વિનંતી કરવાથી ઉપલબ્ધ છે.

વૈકલ્પિક સ્વરૂપે અરજીઓ વિનંતી કરવાથી ઉપલબ્ધ થશે.

અરજી ફોર્મ્સ ઇમેલથી, ટપાલથી કે રૂબરૂમાં સીટી ક્લાર્કની ઓફિસે શુક્રવાર, જાન્યુઆરી 18, 2019 નાં રોજ મોડામાં મોડા સાંજે 4:30 વાગ્યા સુધીમાં અચૂક મોકલવા રહ્યા.

વધુ માહિતી જરૂરી મેળવવા રહેવાસીઓ અહીં સંપર્ક કરી શકે છે:

City Clerk's Office, Brampton City Hall
2 Wellington St W, Brampton, ON L6Y 4R2
905-874-2101, cityclerksoffice@brampton.ca

અવતરણ (ક્વોટ):

“આપણાં શહેરમાં પ્રભાવી બનવા ઇચ્છતા બ્રામ્પટનવાસીઓએ નાગરિક નિમણૂક માટે અરજી કરવી જોઈએ. માહિતગાર નિર્ણય લેવાનું માત્ર રહેવાસી સલાહકારો સાથે શક્ય બને છે – એટલે જ નાગરિક આધારિત સલાહકારી સમિતિઓ, ન્યાય-વિષયક સમિતિઓ, વહીવટી પંચ અને સંબંધિત નિમણૂકો બ્રામ્પટનમાં બહુ નિર્ણાયક છે. આપણે સાથે મળીને, પ્રભાવ પાડી શકીએ છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કૉનેડાના ઇનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણાવો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

વેબસાઇટનેટર, મીડિયા ઍન્ડ વર્મિઉનિટી ઍનગેજમેન્ટ

સ્ટ્રેટજિક વર્મિઉનિવેસન

સિટી ઍન્ડ ટ્રાન્સપોર્ટેશન

905-874-3426 | Monika.Duggal@brampton.ca